



JAP-002-2011002

Seat No. _____

B. Com. (Sem. I) (CBCS) (W.E.F. 2019) Examination

November - 2019

Economics

(Principles of Micro Economics - I)

(New Course)

Faculty Code : 002

Subject Code : 2011002

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) મુદ્દાસર જવાબ આપો.
(૨) દરેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવેલ છે.

૧ ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું ? ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વર્ણવો. ૨૦

અથવા

૧ (અ) સમસીમાંતનો સિદ્ધાંત એટલે શું ? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો આ સિદ્ધાંત મેનેજરને નિર્ણય લેવામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે ? ૧૦

(બ) વટાવનો સિદ્ધાંત સમજાવો. ૧૦

૨ માંગની મૂલ્યસાપેક્ષતા એટલે શું ? માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની રીતો વિગતે સમજાવો. ૨૦

અથવા

૨ (અ) માંગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિબલો સમજાવો. ૧૦

(બ) માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો સમજાવો. ૧૦

૩ ઘટતાં મળતરનો નિયમ આકૃતિની મદદથી સમજાવો. ૧૫

અથવા

૩ (અ) વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો. ૮

(બ) સમખર્ચ રેખા ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો. ૭
સમખર્ચ રેખાનાં લક્ષણો સમજાવો.

- ૪ (અ) લાંબાગાળામાં ખર્ચ અને ઉત્પાદનદર વચ્ચેના આંતરસંબંધો સમજાવો. ૮
 (બ) સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો તપાસો. ૭
- અથવા**
- ૪ (અ) સ્થિરખર્ચ અને અસ્થિરખર્ચનો ખ્યાલ ઉદાહરણ અને આકૃતિની મદદથી ૮
 સમજાવો.
 (બ) પેઢીના ખર્ચનો આધુનિક અભિગમ સમજાવો. ૭

ENGLISH VERSION

- Instructions :** (1) Write to the point
 (2) Mark of each question is indicated on right side.

- 1 What is business economics ? Explain the nature and scope of business economics. 20
- OR**
- 1 (A) What is equi-marginal principle ? Make clear by illustration. How this theory becomes helpful so the manager in taking decision ? 10
 (B) Explain the principle of discount. 10
- 2 What is price elasticity of demand ? Explain the methods of measuring the price elasticity of demand. 20
- OR**
- 2 (A) Explain the factors affecting the price elasticity of demand. 10
 (B) Explain the kinds of price elasticity of demand. 10
- 3 Explain the law of decreasing returns with the help of diagram. 15
- OR**
- 3 (A) Explain the principle of marginal productivity of distribution. 8
 (B) Explain iso-cost curve with illustration and figure what are the characteristic of iso-cost curve ? 7
- 4 (A) Explain the interrelationship between cost and production in long run. 8
 (B) Examine the interrelationship between average cost and marginal cost. 7
- OR**
- 4 (A) Explain the concepts of fixed cost and variable cost with examples and figures. 8
 (B) Explain the modern approach to cost of the firm. 7